



ISO 9001:2015 REGISTERED FIRM

**SANRHEA**  
TECHNICAL TEXTILES LIMITED

Date: 04.08.2022

To,  
**BSE limited**  
Department of Corporate Services  
P J Towers, Dalal Street,  
Mumbai - 400001.  
**Security Code : 514280**

Dear Sir/Madam,

**Subject: Newspaper publication of Extract of Unaudited Financial Results for the quarter ended June 30, 2022.**

---

Pursuant to provisions of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 please find enclosed copy of the newspaper publication of 'Extract of Unaudited Financial Results for the quarter ended June 30, 2022.

Kindly take the same on your record.

Yours Faithfully,

**For, Sanrhea Technical Textiles Limited**

**Dharmesh Patel**  
**(Company Secretary)**



**Encl. : As Above**

**Corporate Office & Works :** Dr. Ambedkar Road, Kalol (N.G.) 382721. **Phone :** (02764) 225204, 227831 **Fax :** (02764) 227696.

**Regd. Office :** Parshwanath Chambers, 2nd Floor, Nr. New RBI, Income Tax, Ahmedabad – 380014.

**Tel. Fax :** (079) 27545646 **Email :** sanrhea@gmail.com **Web. :** www.sanrhea.com

**CIN : L17110GJ1983PLC006309**

Q1 REPORT

# FMCG industry sees recovery on urban buying: NielsenIQ

'Customers buying smaller packs as both traditional kirana stores and modern supermarkets clock business'

SHARLEEN D'SOUZA  
Mumbai, 2 August

Consumption of fast-moving consumer goods (FMCG) like packaged foods, beverages, and toiletries revived in the April-June quarter in urban markets but was negative in rural India as people opted for smaller packs, said NielsenIQ on Tuesday.

Overall volumes recovered to minus 0.7 per cent from minus 4.1 per cent in the quarter ended March. The FMCG market grew 10.9 per cent in the quarter ended June compared to 6 per cent in the January-March quarter.

"The industry also observes positive momentum in volume along with price-led growth," NielsenIQ said in a press statement.


Modern trade comprising hypermarkets and supermarkets continued to clock volume growth (7.8 per cent in April-June over 5.5 per cent in January-March). Traditional trade comprising kirana stores recovered as well (from minus 4.9 per cent in January-March to minus 1.5 per cent in April-June).

Unit growth for the entire sector bounced back to 8.9 per cent in the quarter ended June from 1.5 per cent in the quarter ended March, indicating consumers are buying smaller packs and more units. "Overall, this quarter sees a consumption revival across categories in FMCG, primarily led by a jump in unit growth. Urban markets have turned towards a positive consumption growth, and rural markets are follow-



## BACK IN THE GAME

Value growth versus year ago (in %)



\*Forecast Source: NielsenIQ

ing closely," said Satish Pillai, managing director, NielsenIQ India. "This beats the last two quarters of consumption decline and highlights the onset of cautious optimism among consumers. Also, the consumption recovery and promising macro factors support NielsenIQ's forecast of double-digit growth for 2022" he said.

"Within both foods and non-foods, there is a drop in average pack size growth and consumers continue to prefer smaller packs which is evident by the high unit growth. Grammage reduction is also a catalyst for this behavior to a great extent. Manufacturers and retailers must keep an eye on the changing consumer preferences and manage their portfolio accordingly by ensuring availability of small packs in maximum stores", said Sonika Gupta, customer success lead (India), NielsenIQ.

The foods segment has seen a positive volume growth of 1.8 per cent in the April-June quarter as non-foods continue to be negative, there is a marginal uptick (minus 6.4 per cent in April-June versus minus 9.6 per cent in January-March). Non-essential personal care categories, such as perfumed deodorants and colognes, recorded more than 40 per cent volume growth, on the back of summer season. Skin creams, coconut oil, hair dyes, and talcum powder too had positive volume growth over the same period last year.

NielsenIQ forecasted that the FMCG sector would grow 8-10 per cent this year, considering government policies, inflationary pressures, and other macroeconomic factors. "The first half of the year had an 8 per cent value growth, indicating an overall positive outlook for 2022. This is echoed in the forecast for the year with the industry slated for a double-digit growth rate for the full year of 2022," said Rajesh S Shirali, data science market and client engagement lead, NielsenIQ India. In 2021, India's FMCG market grew 17.5 per cent.

# Mohit Malhotra quits as MD & CEO of Godrej Properties; Gaurav to take helm

PRESS TRUST OF INDIA  
New Delhi, 2 August

Realty firm Godrej Properties' MD and CEO Mohit Malhotra has resigned from the company, and Gaurav Pandey will succeed him with effect from January 1 next year.

In a regulatory filing, the company informed that "Mohit Malhotra has resigned as the Managing Director and Chief Executive Officer" to pursue opportunities outside Godrej Properties with effect from the close of business hours on December 31, 2022.

His resignation has been accepted by the board of directors at its meeting held on Tuesday.

Pandey, who is currently serving as Chief Executive Officer-North Zone, has been appointed as the Managing Director and Chief Executive Officer of the company with effect from



Mohit Malhotra's resignation was accepted by the board on Tuesday

January 1, 2023.

This appointment was also approved by the board.

Godrej Properties is one of the leading real estate developers in the country. It is part of the business conglomerate Godrej group.

# Firm's Q1 profit nearly trebles, bookings up 5x

PRESS TRUST OF INDIA  
New Delhi, 2 August

Godrej Properties on Tuesday said its consolidated net profit in the June quarter nearly trebled to ₹45.55 crore while sales bookings jumped five times to ₹2,520 crore.

The company's net profit stood at ₹17.03 crore in the year-ago period.

Total income rose to ₹426.40 crore in April-June 2022-23 from ₹261.99 crore in the year-ago period, according to a regulatory filing.

On the operational

front, Godrej Properties said its total sales bookings jumped five folds to ₹2,520 crore in the first quarter of this fiscal year from ₹497 crore in the year-ago period.

"Having delivered our highest ever Q1 bookings of ₹2,520 crore, we are on track to meet our FY23 objective of achieving ₹10,000 crore booking value. Despite elevated inflation and recent interest rate hikes, the real estate sector has been exceptionally resilient," said Pirojsha Godrej, executive chairman, Godrej Properties. He expects the

sector to continue to strengthen in the coming quarters.

"...we will be focused on significant market share gains through new project acquisitions and launches. We have a robust launch pipeline for rest of the year which will help us build on the current momentum," Pirojsha said.

Godrej Properties is one of the leading real estate developers in the country. The company has a major presence in Delhi-NCR, Mumbai Metropolitan Region, Bengaluru, and Pune property markets.

**BEFORE THE HON'BLE NATIONAL COMPANY LAW TRIBUNAL, CHENNAI BENCH**  
CP NO. 1 OF 2022 CONNECTED WITH CA/736/CAA/2020 IN THE MATTER OF SECTION 61, 66, 230-232 OF THE COMPANIES ACT, 2013 READ WITH COMPANIES (COMPROMISES, ARRANGEMENTS AND AMALGAMATIONS) RULES, 2016 AND IN THE MATTER OF SCHEME OF AMALGAMATION OF NEELAMANGALA INVESTMENTS AND HOLDINGS PRIVATE LIMITED WITH AIKYAM HOLDINGS PRIVATE LIMITED

**AIKYAM HOLDINGS PRIVATE LIMITED**  
a Company incorporated under the Companies Act, 1956 having its Registered Office at 5/82, Blue Beach Road, Neelankarai, Chennai - 600 041, TN Represented by its Managing Director Mr. RAMESH KYMAL

... PETITIONER/ TRANSFEREE COMPANY

**NOTICE OF PETITION**

A Petition for sanctioning the Scheme of Amalgamation of Neelamangala Investments and Holdings Private Limited (Transferor Company) with Aikyam Holdings Private Limited (Petitioner/ Transferee Company) u/s 61, 66 and 230-232 of the Companies Act, 2013, was submitted by the Petitioner Company with the Hon'ble National Company Law Tribunal, Chennai Bench on 13.07.2022. The said Petition is fixed for hearing before the Hon'ble National Company Law Tribunal, Chennai Bench on 07.09.2022. Any person desirous of supporting or opposing the said Petition shall send to the Petitioner Company and to the Authorised Representative, V. Mahesh & Associates (Address: No. 12/22, 11nd Floor, 7 th Main Road, R.A.Puram, Chennai - 600028, e-mail: maheshvenki@vmacs.co.in), his / her intention, signed by him / her with his / her name and address, not later than 2 days before the date of hearing of the Petition. Where he / she seeks to oppose to the said Petition, the grounds of opposition or a copy of Affidavit shall be furnished with such notice. A copy of the Petition shall be furnished by the undersigned to any person requiring the same on payment of prescribed charges for the same. Dated this **Wednesday, the 3rd day of August, 2022, at Chennai.**

---Sd/---  
**V. MAHESH, P.C.S.**  
**AUTHORISED REPRESENTATIVE OF PETITIONER**  
Add: 12/22, 2nd Floor, 7th Main Road, RA Puram, Chennai - 600028.

**SANRHEA**  
**SANRHEA TECHNICAL TEXTILES LIMITED**  
CIN: L17110GJ1983PLC006309  
Regd Office: Parshwanath Chambers, 2nd Floor, Nr. New RBI, Income Tax, Ahmedabad - 380 014. Phone: (02764) 225204 E-mail: sanrhea@gmail.com Website: www.sanrhea.com

Quarter-1 2022-23 YoY (Rs. in Lakhs)

REVENUE: 1805 (18% YoY)  
EBITDA: 138 (44% YoY)  
PAT: 67 (88% YoY)

**Extract of Unaudited Financial Results for the Quarter Ended on 30.06.2022**  
(Rs. in Lakhs Except EPS)

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended
		30.06.2022	30.06.2021	30.06.2021
		Unaudited	Unaudited	Audited
1	Total Income from operations	1804.85	1526.32	6857.15
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	90.38	48.05	624.83
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	90.38	48.05	624.83
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	67.06	35.74	447.23
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	66.54	36.08	445.14
6	Equity Share Capital	430.00	379.00	430.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	1.56	0.94	11.19
	(a) Basic	1.39	0.94	10.45
	(b) Diluted			

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and on Company's website www.sanrhea.com

Place: Ahmedabad Date: 02.08.2022

For **SANRHEA TECHNICAL TEXTILES LIMITED**  
Tushar Patel (Managing Director)  
DIN: 00031632

# SpiceJet: Cleared all outstanding AAI dues

PRESS TRUST OF INDIA  
New Delhi, 2 August

SpiceJet on Tuesday said it has entered into an agreement with the Airports Authority of India (AAI) and cleared all outstanding principal dues of the airport operator.



"With this, SpiceJet will no longer remain on 'cash and carry' at AAI-run airports across the country and will revert to advance payment mechanism for daily flight operations," the airline's statement noted.

The Centre-run AAI had in 2020 put SpiceJet on a 'cash and carry' basis as the carrier was unable to clear its previous dues.

In the 'cash and carry' model, the airline has to make daily payments to the AAI for various charges — navigation, landing, parking,

and others — to operate flights. SpiceJet said on Tuesday: "In another big boost for the airline, AAI will release SpiceJet's ₹50 crore bank guarantee following the airline clearing all its principal dues. This will result in additional liquidity for the airline." SpiceJet has been making losses for the last four years. It incurred net losses of ₹316 crore, ₹934 crore and ₹998 crore in 2018-19, 2019-20 and 2020-21, respectively.

In the April-December period of 2021, the airline

posted a net loss of ₹1,248 crore. The airline is yet to declare results for January-March period of 2022.

Aviation regulator DGCA had on July 27 ordered SpiceJet to operate not more than 50 per cent of its flights, which were approved for summer schedule, for a period of eight weeks.

On July 6, the Directorate General of Civil Aviation (DGCA) had issued a show-cause notice to SpiceJet following at least eight incidents of technical malfunction in its aircraft since June 19.

# SP Group's stake in Jammu highway project sold to NIIF

PRESS TRUST OF INDIA  
New Delhi, 2 August

The Shapoorji Pallonji Group on Tuesday announced the divestment of its entire shareholding in SP Jammu Udhampur Highway Ltd to the National Investment and Infrastructure Fund (NIIF) for an undisclosed amount.

The group in a statement said SP Jammu Udhampur Highway Ltd is the developer for the Jammu-Udhampur highway project under a concession from the

National Highways Authority of India (NHAI) on a build-operate-transfer (annuity) basis.

According to the statement, the 64.5-km long four-lane Jammu Udhampur Highway is of strategic national interest in India and enhances connectivity to the Vaishno Devi Shrine.

It said the Jammu-Udhampur Highway was also one of the first projects in the highway sector to raise significant US dollar external commercial

borrowings during the construction phase and subsequently refinancing the same through listed non-convertible debentures.

National Investment and Infrastructure Fund is a collaborative investment platform for international and Indian investors, anchored by the Government of India, which manages funds with investments in different asset classes and diversified sectors.

Shapoorji Pallonji Infrastructure Capital is a leading infrastructure development company, primarily focused on the power, roads, and port sectors.

**orbit exports ltd.**  
Regd. Office: 122, Mistry Bhavan, 2<sup>nd</sup> Floor, Dinshaw Wachha Road, Mumbai - 400020, Tel.: 66256262; Fax: 22822031; email: investors@orbitexports.com; website: www.orbitexports.com; CIN: L40300MH1983PLC030872

**Extract of Unaudited Financial Results (Standalone & Consolidated) for the Quarter ended June 30, 2022**  
(₹ in Lakhs)

Sr. No.	Particulars	STANDALONE			CONSOLIDATED		
		Quarter Ended		Year Ended	Quarter Ended		Year Ended
		30.06.2022	30.06.2021	31.03.2022	30.06.2022	30.06.2021	31.03.2022
		Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Audited
1	Total income from operations	5,068.37	1,961.91	12,310.70	5,197.23	2,017.49	12,674.82
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	1,410.21	209.26	2,160.19	1,558.05	246.46	2,356.70
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	1,410.21	209.26	2,108.51	1,558.05	246.46	2,305.02
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	1,067.30	171.99	1,583.93	1,213.53	208.01	1,779.82
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,066.55	168.29	1,556.83	1,255.54	203.17	1,760.97
6	Equity Share Capital	2,738.31	2,738.31	2,738.31	2,738.31	2,738.31	2,738.31
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	15,539.85	-	-	16,720.53
8	Earning per share (of ₹10/- each) (not annualised)	Basic : 3.90			Basic : 4.43		
	Basic and Diluted	Diluted: 3.88	0.63	5.80	Diluted: 4.41	0.76	6.50

**Notes:**

- The above Unaudited Financial Results (Standalone & Consolidated) of the Company for the quarter ended June 30, 2022 have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their respective meetings held on August 01, 2022. The Statutory Auditors have carried out a limited review of these results.
- The above is an extract of the detailed format of the Unaudited Financial Results (Standalone & Consolidated) filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) (BSE: <http://www.bseindia.com> and NSE: <http://nseindia.com>) and the website of Orbit Exports Limited (<http://www.orbitexports.com>).

For **Orbit Exports Limited**  
Sd/---  
**Pankaj Seth**  
Chairman & Managing Director  
DIN: 00027554

Place: Mumbai Date: August 1, 2022





Statement of Consolidated Unaudited Financial Results for the Quarter ended June 30, 2022

(₹ in lakhs, except per share data)

Particulars	3 Months ended		Year ended
	30-Jun-2022 (Unaudited)	30-Jun-2021 (Unaudited)	31-Mar-2022 (Audited)
Total Income from operations	136148	111146	469404
Net Profit/(loss) for the period (before tax and exceptional items)	8868	12389	58046
Net Profit/(loss) for the period before tax (after exceptional items)	8868	12389	57375
Net Profit/(loss) for the period after tax (after exceptional items)	6645	9230	42406
Total comprehensive income for the period [Comprising Profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	6471	9214	42960
Equity share capital	2418	2418	2418
Other equity			18867
Earnings per share of ₹ 1/- each (not annualised)			
(a) Basic (in ₹)	2.75	3.82	17.54
(b) Diluted (in ₹)	2.75	3.82	17.54

Notes:  
1. Summarised Standalone Unaudited Financial Performance of the Company is as under:

(₹ in lakhs)

Particulars	3 Months ended		Year ended
	30-Jun-2022 (Unaudited)	30-Jun-2021 (Unaudited)	31-Mar-2022 (Audited)
Total Income from operations	136043	110783	467744
Profit/(loss) before tax (after exceptional items)	7964	11624	51996
Profit/(loss) after tax (after exceptional items)	5957	8639	38216
Total comprehensive income	5811	8624	38339

2. The above is an extract of the detailed format of Financial Results for the Quarter ended June 30, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Financial Results for the Quarter ended June 30, 2022 are available on the websites of Stock Exchange(s) (www.bseindia.com and www.nseindia.com) and on the website of Company (www.trivenigroup.com).

For TRIVENI ENGINEERING & INDUSTRIES LIMITED  
Sd/-

Place: Mysuru, Karnataka  
Date: August 3, 2022  
Dhruv M. Sawhney  
Chairman & Managing Director

Regd. Office: A-44, Hosiery Complex, Phase-II Extension, Noida, Uttar Pradesh - 201 305.  
Corp. Office: 8<sup>th</sup> Floor, Express Trade Towers, 15-16, Sector-16A, Noida, Uttar Pradesh - 201 301.  
www.trivenigroup.com | CIN : L15421UP1932PLC022174

#BSMorningShow



Are Indian start-ups writing a new script towards profitability?



What is keeping Adar Poonawalla busy these days?



Is the rupee's current strength sustainable?



presents

The Business Standard  
**MORNING SHOW**

Mon - Fri | 8am

Get the answers in today's episode



Visit [mybs.in/MorningShow](http://mybs.in/MorningShow) or scan this code to watch.

bsindia bsindia

business-standard.com

SANRHEA TECHNICAL TEXTILES LTD.  
CIN: L17110GJ1983PLC006309

**CORRIGENDUM**  
In reference to the "Extract of Unaudited Financial Results for the Quarter Ended on 30.06.2022" published on 03.08.2022, The Heading of Third Column is to be read as Year Ended 31.03.2022 instead of 30.06.2021.

**MONTE CARLO**

It's the way you make me feel

**Monte Carlo Fashions Limited**

(CIN: L51494PB2008PLC032059)

Registered/Corporate Office: B-XXIX-106, G.T. Road, Sherpur, Ludhiana-141003, Punjab  
Tel.: 91-161-5048610-40, Fax: 91-161-5048650,  
Email: [info@montecarlo.in](mailto:info@montecarlo.in), Website: <http://www.montecarlo.in>

Statement of unaudited financial results for the quarter ended 30 June 2022

(₹ in lakhs)

Sr. No.	Particulars	Standalone				Consolidated		
		3 months ended 30.06.2022	Preceding 3 months ended 31.03.2022	Corresponding 3 months ended in the previous year 30.06.2021	Previous year ended 31.03.2022	3 months ended 30.06.2022	Preceding 3 months ended 31.03.2022	Previous year ended 31.03.2022
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Audited)
1	Revenue from operations	11,286.76	16,246.64	4,169.87	90,432.20	11,286.76	16,246.64	90,432.20
2	Profit/(Loss) for the period (before tax)	(533.74)	1,643.37	(1,284.69)	15,257.50	(533.74)	1,634.01	15,248.14
3	Profit/(Loss) for the period (after tax)	(391.84)	1,285.30	(1,018.09)	11,403.58	(391.84)	1,275.94	11,394.22
4	Total comprehensive (loss)/income for the period	(370.31)	993.88	(894.49)	11,436.59	(370.31)	984.52	11,427.23
5	Paid-up equity share capital (face value of ₹ 10 each)	2,073.21	2,073.21	2,073.21	2,073.21	2,073.21	2,073.21	2,073.21
6	Other equity	-	-	-	66,662.60	-	-	66,653.24
7	Earnings/(loss) per share (face value of ₹ 10 each) (not annualised for the quarters)							
	(a) Basic (in ₹)	(1.89)	6.20	(4.91)	55.00	(1.89)	6.15	54.96
	(b) Diluted (in ₹)	(1.89)	6.20	(4.91)	55.00	(1.89)	6.15	54.96

Notes:  
1. The above consolidated and standalone financial results for the quarter ended 30 June 2022 have been reviewed by the Audit Committee and taken on record by Board of Directors in their respective meeting held on 03 August 2022. These financial results have been subjected to limited review by the statutory auditors of the Company.  
2. The above is an extract of the detailed format of quarterly unaudited financial results filed with the stock exchanges under regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 for the quarter ended June 30, 2022. The full format of the unaudited quarterly financial results are available on the Stock Exchange websites (www.nseindia.com & www.bseindia.com) and on company's website (www.montecarlo.in).  
3. The figures of the previous quarter ended 31 March 2022 as reported in these standalone financial results are the balancing figures between audited figures in respect of full financial year and the published year to date figures upto the third quarter of the previous financial year. Also the figures upto the end of the previous third quarter were only reviewed and not subject to audit.

For and on behalf of Board of Directors  
Sd/-

Place : Ludhiana  
Date : 3 August 2022  
Jawahar Lal Oswal  
Chairman and Managing Director  
(DIN: 00463866)

Product Range :



**SANDHAR**  
Growth. Motivation. Better Life

**SANDHAR TECHNOLOGIES LIMITED**

CIN: L74999DL1987PLC029553

Regd. Office: B - 6/20, L.S.C. Safdarjung Enclave, New Delhi 110029

Tel: 0124 - 4518900

E-mail: [investors@sandhar.in](mailto:investors@sandhar.in)

Website: [www.sandhargroup.com](http://www.sandhargroup.com)



**FOSTERING INNOVATION AND GROWTH**

EXTRACT OF CONSOLIDATED AND STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2022

(₹ in lakhs, except per equity share data)

Sl. No.	Particulars	Consolidated			Standalone		
		Quarter ended		Year ended	Quarter ended		Year ended
		30 June 2022	30 June 2021	31 March 2022	30 June 2022	30 June 2021	31 March 2022
1	Revenue from Operations	67,509.79	41,007.32	2,32,370.23	57,053.23	31,767.40	1,94,101.58
2	Net Profit for the period (before tax, exceptional item and share of loss in joint ventures)	2,159.86	495.43	9,526.69	2,165.94	134.73	8,742.03
3	Net Profit for the period (before tax after exceptional item and share of loss in joint ventures)	1,876.01	176.80	8,144.24	2,165.94	134.73	8,631.67
4	Net Profit for the period (after tax, exceptional item and share of loss in joint ventures)	1,271.39	211.21	5,592.93	1,579.92	98.93	6,142.68
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the Period after Tax and Other Comprehensive Income after Tax)	1,233.87	161.55	6,082.78	1,513.96	(2.09)	5,922.25
6	Equity Share Capital	6,019.07	6,019.07	6,019.07	6,019.07	6,019.07	6,019.07
7	Total Reserves	-	-	79,875.08	-	-	79,975.31
8	Earnings Per Share (Face value of ₹ 10/- per share) (not annualised for quarter)						
	1. Basic:	2.11	0.35	9.29	2.62	0.16	10.21
	2. Diluted:	2.11	0.35	9.29	2.62	0.16	10.21

Note:  
a) The above is an extract of the detailed format of Quarter ended 30 June 2022 of Consolidated and Standalone Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended Financial Results are available on the websites of the BSE and NSE at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) respectively and on Company's website at [www.sandhargroup.com](http://www.sandhargroup.com).

Place: Gurugram (Haryana)  
Dated: 03 August 2022

For Sandhar Technologies Limited  
JAYANT DAVAR  
Co-Chairman and Managing Director

તહેવારોમાં રાજ્યના ૭૦ લાખથી વધુ એન.એફ.એસ.એ.કાર્ડ ધારકોને

રાહતદરે ૩બલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ પરિવારો તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે જાહેર વિતરણ કે, રાજ્યના હેઠળ રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને દિવાળી બંને તહેવારોને ધ્યાનમાં

આજાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'અમૂલ' દ્વારા કરોડ ધુધની થેલી ઉપર 'હર ઘર તિરંગા'ના લોગો ચિત્રિત કરાયા : વાઘાણી

તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈના વડપણ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૧૮૦ કરોડ પ્રતિ લિટરની પડતર કિંમત સામે સરકાર દ્વારા રૂ. ૮૭ કરોડ પ્રતિ લિટરની સબસીડી આપીને લાભાર્થીઓને માત્ર રૂ. ૧૦૦ પ્રતિલિટરના રાહત ભાવથી આ તેલનું વિતરણ કરવામાં આવશે. અગ્ર અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના અગ્ર અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ૭૦ લાખથી વધુ કાર્ડ ધારકો કે જેની જન સંખ્યા ૩.૫ કરોડ જેટલી થાય છે તેમને તહેવારોની ઉજવણી દરમિયાન રાહત દરે

આજથી તા. ૧૨ દરમિયાન ૮ મનપામાં 'હર ઘર તિરંગા યાત્રા'નું આયોજન; મુખ્યમંત્રી સુરતથી હર ઘર તિરંગા યાત્રા શુભારંભ કરાવશે

કરવામાં આવ્યા છે. આવી જ રીતે સ્ટેમ્પ-ટીકીટોમાં પણ આ લોગો પ્રિન્ટ કરી દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે આવકરદાયક છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારી ખાનગી અને સહકારી તમામ

પાંચ વર્ષમાં રૂ. ૭ હજાર કરોડના મુડીરોકાણ સાથે

L & T પ્રત્યક્ષ-પરોક્ષ મળી ૧૦ હજાર નવા રોજગાર અવસર પૂરા પાડશે

ગાંધીનગર તા.૩ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે જાહેર કરેલી આઈ.ટી.એસ. (૨૦૨૨-૨૩) પોલીસિને વ્યાપક ફળદાયી પ્રતિસાદ મળી રહ્યો છે. આ સંદર્ભમાં ગુજરાતે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વિશ્વવિખ્યાત ઉદ્યોગ જૂથ લાસન એન્ડ ટુબ્રો લિમિટેડ દ્વારા વડોદરા નજીક

લાસન એન્ડ ટુબ્રો લીએ વડોદરા નજીક આઈટી ટેકનોલોજી પાર્કમાં વધુ રોકાણો માટે રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યા

ગુજરાતમાં આઈ.ટી.એસ. એવેલીઈએસ પોલીસિ અંતર્ગત વિવિધ આઈ.ટી.કંપનીઓ, ઉદ્યોગોની વ્યાપક ભાગીદારી સાથે રાજ્યની આઈટી ઈકો સિસ્ટમને વધુ વિકસાવવામાં આ એમ.ઓ.યુ. એક સિમાચિન્હ

મુખ્યમંત્રી-સાયન્સ ટેકનોલોજી મંત્રીની ઉપસ્થિતિ

બની રહેશે. L & T આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં આ આઈ.ટી. પાર્કમાં ૭ હજાર કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરશે. એટલું જ નહિ વડોદરાના આ ટેકનોલોજી પાર્કમાં એક જ વર્ષમાં બે હજાર ઈજનેરો અને અન્ય જગ્યાઓ માટે રોજગાર અવસર મળતા થશે. આગામી પાંચ વર્ષમાં ૬૫ કરોડ અને ઈન્ડસ્ટ્રીએક્ટ એમ્પ્લોયમેન્ટ મળી કુલ ૧૦



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે જાહેર કરેલી આઈ.ટી.એસ. (૨૦૨૨-૨૩) પોલીસિને વ્યાપક ફળદાયી પ્રતિસાદ મળી રહ્યો છે. આ સંદર્ભમાં ગુજરાતે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વિશ્વવિખ્યાત ઉદ્યોગ જૂથ લાસન એન્ડ ટુબ્રો લિમિટેડ દ્વારા વડોદરા નજીક

ગાંધીનગર તા.૩ આઈ.ટી.એસ. એવેલીઈએસ પાર્કમાં વધુ રોકાણો માટે રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અને સાયન્સ ટેકનોલોજી મંત્રી જિતુ વાઘાણીના માર્ગદર્શનમાં આ એમ.ઓ.યુ. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને L & T એ કર્યા હતા.

જેનીય હેલ્થકેર લિમિટેડ

રજી. ઓફિસ : 504, ઉંચકોન એલીગન્સ, આનંદધામ જૈન દેરાસર પાસે, પ્રહલાદનગર કોસ રોડ, અંસ.જી. રોડ, અમદાવાદ - 380015. CIN NO. : L2431GJ1994PL0223574 નોટિસ આથી જણાવવામાં આવે છે કે રેગ્યુલેશન 29 અને સેબીના અન્ય કોઈપણ નિયમ (લીસ્ટીંગ ઓબીગેશન તથા ડિસ્કલોઝર રીકવરવરમેન્ટ) રેગ્યુલેશન 2015 ના અન્વયે નોટિસ આપવામાં આવે છે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ સુધાર, 12મી ઓગસ્ટ, 2022 ના રોજ બપોરે ૧૦:૦૦ વાગે કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ 504, ઉંચકોન એલીગન્સ, આનંદધામ જૈન દેરાસર પાસે, પ્રહલાદનગર કોસ રોડ, અંસ.જી. રોડ, અમદાવાદ - 380015 ખાતે નીચેની કાર્યવાહી માટે બંધવશે. 1) 30મી જૂન 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે કંપનીના અન-ઓડિટેડ નાણાકીય પરિણામોને ધ્યાનમાં લેવા અને મંજૂર કરવા. 2) અધ્યાક્ષ અને બહુમતી ડિરેક્ટરોની પરવાનગી સાથે અન્ય કોઈપણ બાબત. અમે વધુમાં જણાવવાનું કે સેબી (પ્રોલિબિશન ઓફ ઈન્સાઈડર ટ્રેડિંગ) રેગ્યુલેશન્સ અને કંપનીના ઈન્સાઈડર ટ્રેડિંગના નિવારણ માટેની આચારસંહિતા મુજબ, કંપનીની સિક્યોરિટીમાં વહેવાર કરવા માટેનો ટ્રેડિંગ વિંડો, જે અખાઉ બંધ હતો, જે ૩૦ જૂન ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની ઘોષણા પછી ૪૮ કલાક સુધી બંધ રહેશે. જેનીય હેલ્થકેર લિમિટેડ વતી (મિલિટ એસ. સાઇ) કંપની સંકેતરી - ACS NO. 41922

સ્થળ : અમદાવાદ તારીખ : 03-08-2022

એકમ ગીરો મુકેલ સોનાની દરમી વેચાણ

યુકો બેંક નેચે દ્વારા દરમી મુકેલ સોનાની દરમી વેચાણ અંગેની નોટિસ આપવામાં આવેલ છે. જેના અનુસંધાને યુકો બેંકના (સામા મેનેજર) સિલોડા સાથે ઈપાર્ટનરની બાકી રકમ વ્યાજ સુધીની આપવા નોટિસ આપવામાં આવેલ હતી. પરંતુ તેના દ્વારા પોતાના અધિકારો / સહિતનો પ્રયોગ કરતાં યુકો બેંકમાં ગીરો મુકેલ સોનાની દરમી દ્વારા તારીખ : ૨૫.૦૮.૨૦૨૨ ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે, સિલોડા સાથે નીચે દર્શાવેલ વિગત પ્રમાણે કરવામાં આવશે.

Table with 4 columns: ઈપાર્ટનરનું નામ, સોનાની કિંમત, ઠાકી ઢીલો રકમ, ઠાકી ઢીલો રકમ. Rows include સમીર અમૃતલાલ શર્મા, ડી-૧૪, સાયોપી સીટી પાર્ક - ૪, આર.સી. ટેકનૉલોજી, યાદલોડીયા, અમદાવાદ, and ડાંગડી (નંબ-૪), લકી (નંબ-૧).

સ્થળ : અમદાવાદ તારીખ : ૩ ઓગસ્ટ, ૨૦૨૨



જમાલપુરમાં જગન્નાથજીના મંદિરમાં ભગવાનના કુલોના હિંડોળા દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ...

ધ્રાંગધ્રા તાલુકાના મેથાળ અને સરવાડ ગામે વચ્ચેના

તળાવમાં ડૂબી જતા પાંચ બાળકોના મોત

વહવાણ, તા.૩ ધ્રાંગધ્રા તાલુકાના મેથાળ અને સરવાડ ગામની વચ્ચેના તળાવમાં પાંચ બાળકોના ડૂબી જવાની ઘટના બની હતી. આ મૃતકોમાં એક જ પરિવારના ત્રણ બાળકોનો સમાવેશ થયેલ છે. તેઓના મોત નીપજ્યા હતા. ધ્રાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ તપાસ ધ્રાંગધ્રા પોલીસ યથાવીની વાડી અને મેથાળ ગામના વાલજીભાઈની વાડીમાં (ઉ.વ.૫), પી-૧ નારસિંગભાઈ (ઉ.વ.૫), શેકનું વાતાવરણ પ્રસરી ગયું હતું.

યુકો બેંક નેચે દ્વારા દરમી મુકેલ સોનાની દરમી વેચાણ અંગેની નોટિસ આપવામાં આવેલ છે. જેના અનુસંધાને યુકો બેંકના (સામા મેનેજર) સિલોડા સાથે ઈપાર્ટનરની બાકી રકમ વ્યાજ સુધીની આપવા નોટિસ આપવામાં આવેલ હતી. પરંતુ તેના દ્વારા પોતાના અધિકારો / સહિતનો પ્રયોગ કરતાં યુકો બેંકમાં ગીરો મુકેલ સોનાની દરમી દ્વારા તારીખ : ૨૫.૦૮.૨૦૨૨ ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે, નારવણ સાથે નીચે દર્શાવેલ વિગત પ્રમાણે કરવામાં આવશે.

Table with 4 columns: ઈપાર્ટનરનું નામ, સોનાની કિંમત, ઠાકી ઢીલો રકમ, ઠાકી ઢીલો રકમ. Rows include સમીર અમૃતલાલ શર્મા, ડી-૧૪, સાયોપી સીટી પાર્ક - ૪, આર.સી. ટેકનૉલોજી, યાદલોડીયા, અમદાવાદ, and ડાંગડી (નંબ-૪), લકી (નંબ-૧).

adani wilmar

અદાણી વિલ્મર લિમિટેડ

રજિસ્ટર્ડ ઓફિસ: કોર્મ્યુન હાઉસ, નવરંગપુરા રેલવે કોલિંગ પાસે, અમદાવાદ-૩૮૦૦૦૬, ગુજરાત (ભારત). ફોન નંબર: +૯૧-૭૯-૨૬૪૫૬૫૦૦, ફેક્સ નંબર: +૯૧-૭૯-૨૬૪૫૬૬૨૧, સીઆઈએન: L15446GJ1999PL0035320 વેબસાઇટ: www.adaniwilmar.com, ઈ-મેઇલ: investor.relations@adaniwilmar.in

સ્થળ: અમદાવાદ તારીખ: ૩ ઓગસ્ટ, ૨૦૨૨

રાજ્યમાં ૫ ઓગસ્ટથી વરસાદનું જોર વધશે

અમદાવાદ તા.૩ ગુજરાતમાં હાલમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે, અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી તા.૫ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે, આગામી દિવસમાં સક્રિય થનારી વરસાદની સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ લાવશે. આ સાથે અમદાવાદ શહેરમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની સંભાવના છે. આવતીકાલ ગુરુવારે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડશે. ૫મી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. આ દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તા.૬,૭ અને ૮ ઓગસ્ટના રોજ ગુજરાતમાં સારો વરસાદ પડશે. એક-બે જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આગામી ૨૪ કલાકમાં નર્મદા, ભરૂચ, તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આવતીકાલ ૪ થી ૬ ઓગસ્ટ સુધી દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વલસાડ, ડાંગ, નવસારી, તાપી જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.